

બાયસ ક્રાઈમ (પક્ષપાતી વેલણનો અપરાધ)



તેને રિપોર્ટ કરો!

NJOAG.gov/BIAS

પક્ષપાતી વલણની ઘટના શું છે?

પક્ષપાતી વલણની ઘટના અથવા પક્ષપાતી વલણનો અપરાધ એ જાતિ, રંગ, ધર્મ, લગિ, અપંગતા, જાતીય અભિમુખતા, લગિ ઓળખ કે અભિવ્યક્તિ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે વ્યક્તિ અથવા મલિકત (જાહેર કે ખાનગી) વરિદ્ધનું ગેરકાયદેસર કૃત્ય છે.

જો તમે પક્ષપાતી વલણની ઘટનાનો લોગ બનો અથવા તમે તેના સાક્ષી હોવ, તો તમારે શું કરવું જોઈએ?

પ્રથમ તમારે તમારા સ્થાનિક પોલીસ વલિાગને કોઈપણ અને તમામ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલ પક્ષપાતી વલણની ઘટનાઓની જાણ કરવી જોઈએ. જો આ ઈમરજન્સી હોય અથવા અપરાધ ચાલુ હોય તો તરત જ 911 પર કોલ કરો.

જો હું મારા સ્થાનિક પોલીસ વલિાગને જાણ કરવામાં અસ્વસ્થતા અનુભવું તો શું કરવું?

તમે તમારી કાઉન્ટી પ્રોસેક્યુટર ઓફિસને રિપોર્ટ કરી શકો છો. ન્યૂ જર્સીમાં, દરેક કાઉન્ટી પ્રોસેક્યુટર ઓફિસમાં બાયસ ક્રાઈમ યુનિટ છે. આ વશિષ્ટ એકમોને સોપેલ ડિટિક્ટીવો, રિપોર્ટ્સ મેળવવા માટે અને તમામ પક્ષપાતી વલણની ઘટનાઓની તપાસ માટે જવાબદાર છે. તમે www.njoag.gov/bias પર, બાયસ ક્રાઈમ પોર્ટલ દ્વારા bias.njcivilrights.gov પર અથવા **1-800-277-BIAS (2427)** પર કોલ કરીને ન્યૂ જર્સી એટર્ની જનરલ ઓફિસને પણ પક્ષપાતી વલણની ઘટનાની જાણ કરવા માટે તમારે ફક્ત તે જ માહિતી પ્રદાન કરવાની જરૂર છે જે તમે પ્રદાન કરવા માંગો છો. ઘટનાની જાણ કરી શકો છો.

શું મારે મારું નામ અને સંપર્કની માહિતી આપવી પડશે? મારે શું રિપોર્ટ કરવાનું રહેશે?

ના, તમારે તમારું નામ અથવા સંપર્કની માહિતી આપવાની જરૂર નથી, તમે અનામી રૂપે જાણ કરી શકો છો. પક્ષપાતી વલણની ઘટનાની જાણ કરવા માટે તમારે ફક્ત તે જ માહિતી આપવાની જરૂર છે જે તમે આપવા માંગો છો. જો કે, તમે કાયદાના અમલીકરણને જેટલી વધુ માહિતી પ્રદાન કરશો, તેમની તપાસ કરવાની ક્ષમતા એટલી જ સારી રહેશે.

પક્ષપાતી વલણની ઘટનાઓને રિપોર્ટ કરવાનું યાદ રાખો:

- કટોકટી અને બની રહેલા ગુનાની ઘટનાની જાણ કરવા માટે **911 પર કોલ કરો**
- તમારા સ્થાનિક પોલીસ વલિાગનો સંપર્ક કરો
- તમારી કાઉન્ટી પ્રોસેક્યુટર ઓફિસનો સંપર્ક કરો
- NJ એટર્ની જનરલની ઓફિસનો સંપર્ક કરો:
 - બાયસ ક્રાઈમ હોટલાઇન: **1-800-277-BIAS (2427)**
 - બાયસ ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ: **bias.njcivilrights.gov**
 - બાયસ ક્રાઈમ રિસોર્સિસ: **www.njoag.gov/bias**